

સ્મોક અલાર્મ જીવન બચાવે છે!
તમારા ઘરનાં દરેક માળ પર એક જરૂર
ફિટ કરાવો અને તેની બેટરીઓને
નિયમિત રીતે ચકાસતા રહો.



જો આગ લાગી હોય તો...

બહાર જાઓ
બહાર રોકાવ
અને
999 ઉપર ફોન કરો.

- તમારે અને તમારા ઘરની સુરક્ષા માટેનો સર્વોત્તમ ઉપાય છે, સ્મોક અલાર્મ ખરીદવું. સ્મોક અલાર્મની કિંમત માત્ર £5 હોય છે અને એ તમે કોઈ પણ સુપરમાર્કેટ અને હાઈસ્ટ્રીટ સ્ટોરથી ખરીદી શકો છો.



સ્માર્ટ બનો!

માહિતી જે તમારા જીવનને બચાવે છે.

સાધનસજ્જ બનો!

તમારે પોતાની સુરક્ષા માટે મૂડી રોકાણ કરો.

બહાર જાઓ!

યોજના બનાવો. તૈયાર રહો.

“સ્માર્ટ બનો! સાધનસજ્જ બનો! બહાર જાઓ!” શ્રેણીના ચોપાનીયાઓમાંનું આ એક છે. આગ સુરક્ષા શ્રેણી તમારા સ્થાનિક આગ અને બચાવ સેવા પાસે ઉપલબ્ધ છે. શ્રેણીઓમાં બીજા ચોપાનીયાઓ અગ્નિ સુરક્ષા સાધનો, વાલીઓ અને બાળકો માટે અગ્નિ સુરક્ષા અને દુષ્ટિની સમસ્યા અથવા હલનચલનની સમસ્યા ધરાવતી વ્યક્તિઓ માટે વધારાની માહિતી આપે છે.

ભાષાંતર અને વૈકલ્પિક પ્રકાર પણ ઉપલબ્ધ છે.

Published by the Office of the Deputy Prime Minister.
©Crown copyright 2004. Printed in the UK, January 2004,
on material containing 75% post-consumer waste and
25% ECF pulp (03DOCF01123)
Product code: Fire smoking 04gu



વધુ માહિતી માટે અમારો વેબસાઈટ www.firekills.gov જુઓ.

Gujerati

સિગારેટથી લાગેલી આગ

તમારા ઘરને આગથી બચાવો



સિગારેટ સુરક્ષા – જરૂરિયાતો

બીજા કોઈ પણ એક કારણથી લાગેલી આગો કરતાં ધુમ્રપાનથી લાગેલી આગોને લીધે વધારે લોકો મરણ પામે છે. સિગારેટની રચના સળગતી રહેવા માટે કરી હોવાથી તેનાથી આસાનીથી આકસ્મિક આગ લાગી શકે છે.

તમારા ઘર અને કુટુંબને આગથી બચાવો.

સામાન્ય બુદ્ધિ વાપરો – જોખમોને જાણો, અને જ્યારે તમે એને ઓલવો ત્યારે ખાતરી કરી લો કે તે ખરેખર ઓલવાઈ ગઈ છે!

સાચું જીવન – ધુમાડા માટે મરવું?




નીક 21નો હતો અને યુનિવર્સિટીમાં તેનું છેલ્લું વર્ષ હતો. નાતાલ 2001ની અગાઉ, એક રાતે ઘેર આવ્યો અને સોફા ઉપર એ જાણ્યા વગર લાંબી ગયો કે સિગારેટને ઠૂંઠો હજી પણ સળગે છે. સોફા સળગવા માંડ્યો, રૂમમાં ધુમાડો ભરાયો. નીક ગરમીનાં કારણે જાગ્યો પરંતુ ઝેરીલી વરાળથી તે પડી ભાંગ્યો. ત્યાં કોઈપણ સ્મોક અલાર્મ ફિટ કરેલું નહોતું અને સવાર સુધી જાણ ન થઈ. આમ તો આગ નાની હતી પરંતુ તે એટલી પૂરતી હતી કે એક 21-વર્ષની-વ્યક્તિને મારી શકે.

સિગારેટ સુરક્ષા

તેને ઓલવી નાખો, બરોબર ઓલવો!

જ્યારે તમે સિગારેટ ઓલવી નાખો ત્યારે ચકાસો, કે તે ખરેખર બંધ થઈ ગઈ છે.



- જ્યારે તમે લંઘમાં હો, સૂચવેલી દવાઓ લેતા હો, અથવા તમે દારૂ પીતા હો ત્યારે ધુમ્રપાન કરો તો વધારે કાળજી રાખો. સિગારેટ હજુ બળે છે તે ન નોંધવું અને લંઘી જવું ખૂબ સહેલું છે.
- જો તમને સુવાની જરૂરિયાત લાગે તો સિગારેટ સળગાવવી નહીં. લંઘ આવવાનું જોખમ અથવા પલંગને આગ લાગવાનું જોખમ હોવા છતાં લોકો પલંગ ઉપર ધુમ્રપાન કરતા હોય છે.

- લોકો જ્યારે દારૂ પીતા હોય ત્યારે મોટા ભાગે ધુમ્રપાન કરવાનું પસંદ કરે છે. પરંતુ જેણે થોડા ડ્રિંક્સ લીધા હોય તેઓ હાથમાં સળગતી સિગારેટ સાથે જતા રહે છે. પરિણામ? ભયંકર શેતે દાઝવું, કાયમી ડાઘ, અથવા મૃત્યુ.



તમે વિચારો છો તેના કરતાં તે વધારે ગરમ છે – સિગારેટ 700°C કરતાં વધારે તાપમાન પર સળગે છે.

- સિગારેટ, સિગાર અથવા પાઈપને ક્યારેય સળગતી ન મૂકવી. તે જ્યારે સળગતી હોય ત્યારે તેનું સંતુલન બગડી શકે છે અને તે કારપેટ અથવા છાપા ઉપર પડી, આગ લગાડી શકે છે.



- જ્વાબદારી લો અને બાળકોને લાઈટરો અને દિવાસળીથી દૂર રાખો.
- સિગારેટ અને લાઈટરોથી લાગેલી આગથી દર વર્ષે બાળકોનાં મરણ થાય છે, જે તેમની પાસે હોવા જ ન જોઈએ.



- બાળ-રોઘી લાઈટરો અને દિવાસળીઓ ખરીદવાનો આગ્રહ રાખો. હવે દિવાસળીઓ ઉપર આવી ચેતવણીનાં લેબલ આવે છે.



- યોગ્ય એશટ્રે વાપરો. એ ચકાસો કે એશટ્રે ભારે હોય, અને સરળતાથી ઢળી ના પડે, અને એવી વસ્તુથી બનેલી હોય જે સળગી ન શકે.
- કચરાટોપલીમાં કોઈપણ દિવસ રાખ ન પાડો – ફક્ત એશટ્રેમાં જ પાડો. એ ચકાસો કે તે સરળતાથી અથડાય ન જાય અને રાખને ભેગી ન થવા દો.